

આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગવિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરેલ છે. તદાનુસાર, પ્રતિ વર્ષ ૨૧ જુનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલ છે. જેના અનુસંધાને આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી ભવન ખાતે તા.૨૧/૬/૨૦૨૨ ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન માન. કુલપતિશ્રી ડૉ. કે.બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ ડૉ. દિનેશ.એચ. પટેલ, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ દ્વારા કરવામાં આવેલ. આયુષ મંત્રાલય, ભારત સરકારના કોમન યોગા પ્રોટોકોલ મુજબ યોગ કરવામાં આવેલ. જેમાં ડૉ. કે.બી. કથીરીયા, માન. કુલપતિશ્રી, યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, તમામ યુનિટ/સબ યુનિટ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો, એન.સી.સી. ના કેડેટ્સ, ખેતીવાડી મહિલા મંડળના સભ્યશ્રીઓ, યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા પરિવારજનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધેલ. ડૉ. કે.બી. કથીરીયા, માન. કુલપતિશ્રીએ આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં માનવજીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું અને નિયમિતપણે યોગ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અંદાજે ૪૯૦ લોકોએ ભાગ લીધેલ. યોગ પ્રશિક્ષક તરીકે તોરલબેન પટેલે સેવાઓ આપેલ.

